

ત્વરિત જાહેરાત માટે

આપાત્કાલીન પેટ ફૂડ પેન્ટ્રી મારફતે બ્રમ્પટન એનિમલ સર્વિસિસ પોતાની સહાયનો વિસ્તાર કરે છે

બ્રમ્પટન, ઓન્ટારિયો (14 જાન્યુઆરી 2022) – બ્રમ્પટન એનિમલ સર્વિસિસ બ્રમ્પટનમાં પાળેલા પ્રાણીઓના માલિકો જેમને પાળેલા પ્રાણીઓ માટે ખોરાકની આવશ્યકતા હોય અથવા બિલાડી માટેના ખોરાકી પદાર્થ તેમજ તે અતિરિક્ત પ્રાણીઓ માટેનો અનિવાર્ય પુરવઠો જોઈતો હોય તેમને આપાત્કાલીન પેટ ફૂડ પેન્ટ્રીનું લોકાર્પણ કરીને સહાયતા આપશે.

આપાત્કાલીન પેટ ફૂડ પેન્ટ્રીનો હેતુ પાળેલા પ્રાણીઓના માલિકોને એક અઠવાડિયાથી માંડીને એક મહિનો ચાલે એટલો પાળેલા પ્રાણીઓ માટેનો પુરવઠો એક જ સમયે પૂરો પાડવાનો છે જેનો આધાર માંગ અને મળેલ દાન પર રહેશે. બ્રમ્પટન એનિમલ સર્વિસિસ દ્વારા સ્થાનિક PetValu અને FreshCo સાથે ભાગિદારી કરવામાં આવી છે જેથી આ પહેલ શક્ય બની શકી.

વ્યવસાયોને આહવાહન છે કે આ આપાત્કાલીન પેટ ફૂડ પેન્ટ્રીને 905.458.5800 પર કોલ કરીને અથવા

animal.services@brampton.ca પર ઈમેલ કરીને સહાય કરે.

રહેવાસીઓ સીલ કરેલ સુકકા અથવા બિલાડી, શ્વાન અને અન્ય નાના પ્રાણીઓનો કેન કરેલ ખોરાક બ્રમ્પટન એનિમલ સેલ્ટરને દાન કરી શકે છે જે 475 ક્રિસ્લર ડ્રાઇવ (Chrysler Drive) પર સ્થિત છે. આવશ્યક બસ્તુઓની આદી માટે મુલાકાત લે બ્રમ્પટન એનિમલ સર્વિસિસ

[Amazon Wish List](#) અથવા બ્રમ્પટન એનિમલ સર્વિસિસ [Facebook](#) પેજ.

જરૂરિયાતમંદ પેટ (પાળેલા પ્રાણીઓ)ના માલિકો 905.458.5800 પર કોલ કરી એનિમલ સર્વિસિસ પ્રતિનિધિ સાથે વાત કરીને

Animal.Services@brampton.ca પર ઈમેલ કરીને કે [ઓનલાઇન ફોર્મ ભરીને](#) ઈમર્જન્સી પેટ ફૂડ પેન્ટ્રી સુધી પહોંચી શકશે.

બ્રમ્પટન એનિમલ સર્વિસિસ વસ્તુઓને પેક કરીને પિક અપની સૂચનાઓ જારી કરશે. પાળેલા પ્રાણીઓના માલિકો પોતાના પાલતું જાનવરની વિગતો જેમકે તેમની પાસે હોય તે પ્રાણીનો પ્રકાર, તેની સંખ્યા અને તેમના પેટસ એટલેકે પાળેલા પ્રાણીની ઉંમરનો સમાવેશ કરવા જણાવવામાં આવે છે તે સાથે જ શું તેમને કિબલની જરૂર છે કે કેન કરેલ ખોરાક અને કોઈપણ વધારાનો પુરવઠો જે તેમને તેમના પેટસની દરકાર માટે જરૂરી હોય.

ઈમર્જન્સી પેટ ફૂડ પેન્ટ્રી વિશે વધુ માહિતી માટે અહીં મુલાકાત લો www.brampton.ca/animalservices.

સુવાક્ષ્યો

"બ્રમ્પટન એનિમલ સર્વિસિસ ઈમર્જન્સી પેટ ફૂડ પેન્ટ્રી આખા બ્રમ્પટનમાં પેટ માલિકોને આવશ્યક પુરવઠાની સહાય આપશે જથી તેઓ પોતાના પેટસની દરકાર લઈ શકે ખાસ કરીને આવા મુશ્કેલ સમયમાં. ચાલો આપણે આપણા પેટસ અને પરિવારને ભેગા રાખીએ – હું એવા બધાને અમારી ટીમનો સંપર્ક કરવા વિનંતી કરું છું જેમને આની જરૂર હોય."

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

"ઈમર્જન્સી ફૂડ પેન્ટ્રી આપ્ના સમુદાયને પોતાના સંસાધનો એકબીજા સાથે વહેંચવા માટે ભેગો કરે છે અને બ્રમ્પટનના પાલતું પ્રાણીઓને આનંદમાં અને સ્વસ્થ રાખે છે. આ પહેલની સફળતા સમુદાયની ઉદારતા પર નિર્ભર છે. એવા વ્યવસાયો અને રહેવાસીઓ જેઓ આ પ્રોગ્રામને સમર્થન આપતા હોય તેઓને જરૂરી પેટ પુરવઠો દાન કરવા આમંત્રણ પાઠવવામાં આવે છે.

- જેક બોમ્બેન, સિટી કાઉન્સિલર, વોર્ડ 3 અને 4, પ્રમુખ, લેજસ્લેટિવ સર્વિસિસ, સીટી ઓફ બ્રમ્પટન

"દાતાઓ અને ભાગિદારો જેઓ ઈમર્જન્સી પેટ ફૂડ પેન્ટ્રીને શક્ય બનાવશે તેમને ધન્યવાદ. આ મુશ્કેલ સમયમાં આપણા સમસ્ત સમુદાયને સ્વસ્થ અને સલામત રાખવા માટે આ પહેલ મહત્ત્વપૂર્ણ છે. તમારા પેટ્રસ માટે તમને સહાયની જરૂર હોય તો મહેરબાની કરી સંપર્ક કરશો."

- ડુગ વ્હિલ્હાન્સ, સિટી કાઉન્સિલર, વોર્ડ 2 અને 6, ઉપ-પ્રમુખ, લેજસ્લેટિવ સર્વિસિસ, સીટી ઓફ બ્રમ્પટન

"બ્રમ્પટન એનિમલ સર્વિસિસ આપણા મહાન શહેરના તમામ પ્રાણીઓને સંભાળ અને રક્ષણ આપવા સમર્પિત છે. ઈમર્જન્સી પેટ ફૂડ પેન્ટ્રી અનેક પેટ માલિકોને તેમના પેટ્રસ માટે જરૂરી વસ્તુઓ મેળવવામાં અને સુનિશ્ચિત કરવા કે તેઓ આનંદમાં અને સ્વસ્થ રહે તે માટે સહાય કરશે."

- ડેવિડ બાર્રિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ (Media and Community Engagement)

વ્યૂહાત્મક સંવાદ (Strategic Communication)

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca